

ત્વરિત જાહેરાત માટે

## સીટીએ ભાવિ BramptonU (બ્રેમ્પટન યુનિવર્સિટી) માટેનો પાયો ખોદ્યો

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જુલાઈ 24, 2020) – આજે, સીટીએ બ્રેમ્પટનમાં એક સંપૂર્ણ, માન્યતા ધરાવતી યુનિવર્સિટી લાવવા [પોતાની દરખાસ્તના મુખ્ય વ્યૂહાત્મક તત્વોનું પૂર્વાવલોકન](#) બહાર પાડ્યું.

ગત વર્ષ દરમિયાન, સીટીએ પોતાની યુનિવર્સિટી BramptonU માટેની યોજના જાણાવવામાં મદદ મેળવવા, અને બ્રેમ્પટનમાં માધ્યમિક પર્યાત (પોસ્ટ સેકન્ડરી) શિક્ષણ માટે નવા ચપળ અને નવીનતમ મોડેલની દરખાસ્ત રજૂ કરવા, રાયરસન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ ગુલ્ફ-હમ્બર, ધી લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ, ક્વીન મેરી યુનિવર્સિટી ઓફ લંડન, D2L અને અલ્ગોમા યુનિવર્સિટી જેવી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થાઓ અને હિતધારકો સાથે મળીને કામ કર્યું છે.

ગયા અઠવાડિયાની ઘોષણા પ્રમાણે, ઓન્ટેરિયોની કોલેજો અને યુનિવર્સિટીઓ માટે પ્રોવિન્સનું અઘતન *મેજર કેપેસિટી એક્સ્પાન્શન પોલિસી ફેમવર્ક (મોટી ક્ષમતાનું વિસ્તરણ નીતિ માળખું)* આ પ્રકારના વિસ્તરણો માટેના દરવાજા ખોલી નાખે છે.

આ પાનાખર ઋતુમાં આગળ જતા સંપૂર્ણ દરખાસ્ત બનાવીને પ્રોવિન્સ ઓફ ઓન્ટેરિયોને રજૂ કરવાનું કામ ચાલી રહ્યું છે:

- પ્રોવિન્સ ઓફ ઓન્ટેરિયોના અધિનિયમથી એક સ્વાયત્ત જાહેર સંસ્થા તરીકે સ્થાપિત, બ્રેમ્પટન યુનિવર્સિટી વર્ષ 2040 સુધીમાં આશરે 30,000 વિદ્યાર્થીઓ વડે એક પૂરેપૂરી વ્યાપક જાહેર યુનિવર્સિટી બનવાનો હેતુ ધરાવે છે.
- દરખાસ્ત હેઠળની યુનિવર્સિટીની સંચાલન સમિતિમાં હાલના શૈક્ષણિક ભાગીદારો, સ્થાનિક સરકાર અને ધંધાકીય હિતધારકોના સભ્યો, અને પ્રાથમિકથી માધ્યમિક શિક્ષણ ભાગીદારોનો સમાવેશ થશે.
- કાર્યક્રમો મહત્વના વિકસતા ક્ષેત્રો જેમ કે ડિજિટલ ટ્રાન્સફર્મેશન, નવીન શોધ અને ટકાઉપાણું; તેમજ શહેરના અગ્રતા ધરાવતા આર્થિક ક્ષેત્રોને અનુરૂપ બનવાને અગ્રતા આપવા પર ધ્યાન આપશે, આ આર્થિક ક્ષેત્રોમાં સામેલ છે: આધુનિક ઉત્પાદન, નવીન શોધ અને ટેકનોલોજી, ખાદ્યપદાર્થો અને પીણાં પ્રક્રિયાકરણ, અને આરોગ્ય અને જીવન વિજ્ઞાન.

આપણું શહેર વર્તમાન માધ્યમિક પર્યાત શિક્ષણ ભાગીદારો સાથે પોતાના લાંબા-ગાળાના સંબંધો બનાવવા કટિબદ્ધ છે, જેમાં રાયરસન યુનિવર્સિટી, અલ્ગોમા યુનિવર્સિટી અને શેરિડેન કોલેજ સામેલ છે. આ સંસ્થાઓનું બ્રેમ્પટનમાં રોકાણ કરવાનું અને વિકાસ પામવાનું, નવી શૈક્ષણિક અને આર્થિક તકો ઊભી કરવાનું ચાલુ છે.

ઓગસ્ટ 17 થી 19 સુધી, એસોસિએશન ઓફ મ્યુનિસિપાલિટીસ ઓફ ઓન્ટેરિયો (AMO) ની વર્ચ્યુઅલ (આભાસીય) વાર્ષિક કોન્ફરન્સમાં મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown), કાઉન્સિલરો, અને શહેરના અધિકારીઓ સહભાગી થશે. આપણી કાઉન્સિલ શહેર માટે મહત્વના પ્રોજેક્ટ્સ, જેમ કે BramptonU પર ભંડોળ અને સહયોગ વધારવાની વકાલત કરવાનું ચાલુ રાખશે.

BramptonU પર વધુ માહિતી માટે વેબસાઈટ જુઓ, [www.bramptonu.ca](http://www.bramptonu.ca).

### અવતરણો (ક્વોટ્સ):

“વિતેલા કેટલાક મહિનાઓમાં, જોબ માર્કેટ અને આપણે કાર્યરત છીએ તે દુનિયા, બંને સંપૂર્ણપણે બદલાઈ ગયા છે – જેનાથી ભવિષ્ય માટે સૌથી જરૂરી આવડત શ્રેણીઓ (સ્કિલસેટ્સ) આસપાસ વાતચીત વધારવાની જરૂરિયાત ઊભી થઈ છે. કેનેડામાં સૌથી વિશાળ અને સૌથી ઝડપથી વિકસી રહેલા શહેરોમાંના એક તરીકે, બ્રેમ્પટન માટે આપણાં અર્થતંત્રની સ્થિતિસ્થાપકતા અને સફળતાનો અભિન્ન ભાગ એવી

આપણી પ્રતિભાઓને પોષવામાં, ખાસ કરીને આ નિર્ણાયક સમયમાં મદદરૂપ થતી પોતાની સ્વતંત્ર સંચાલન સક્ષમ યુનિવર્સિટી હોવી એ નિર્ણાયક બાબત બની રહે છે. પ્રોવિન્સ દ્વારા માધ્યમિક પર્યંત શિક્ષણમાં ભજવાતી વિકસતી અને નિર્ણાયક ભૂમિકાને ઓળખ આપવાની વાતની હું કદર કરું છું અને આપણે આપણાં ભાવિ વર્કફોર્સમાં કેવી રીતે શ્રેષ્ઠ રોકાણ કરી શકીએ તે અંગે વધુ ચર્ચાઓ કરવા આશાવાદી છું.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રમ્પટન

“આપણે કામ અને શિક્ષણ બંનેના પરંપરાગત મોડેલો જે રીતે પરિવર્તન પામી રહ્યાં છીએ તેને હાલમાં પહેલી વાર જોઈ રહ્યાં છીએ. અમારી BramptonU દરખાસ્ત શિક્ષણ આપવાની નવી, નવીનતમ અને ક્રિક્રાયતી રીત પર આધારિત છે જે આ પડકારભર્યા વર્તમાન દૃશ્ય સાથે અનુરૂપ છે. આ બ્રમ્પટનમાં નિર્મિત ઉકેલ આપણી પ્રતિભાઓને વિકસવામાં અને આપણાં વિકસિત અર્થતંત્રના અભિન્ન અંગ તરીકે તેઓને અહીં રાખવામાં મદદરૂપ થશે.”

- રોવેના સેન્ટોસ (Rowena Santos), પ્રાદેશિક કાઉન્સિલર વોર્ડ્સ 1 અને 5, સીટી ઓફ બ્રમ્પટન

“અમે જાણીએ છીએ કે 83% જેટલા બ્રમ્પટનવાસીઓ બ્રમ્પટન યુનિવર્સિટી ઈરછે છે અને 82% જેટલા બ્રમ્પટનવાસીઓ વધારે લચીલા યુનિવર્સિટી કાર્યક્રમો ઈચ્છે છે. વર્કફોર્સ માટે તૈયારી કરવા યુવાનો જે પ્રકારનું શિક્ષણ અને અનુભવો શોધી રહ્યાં છે તે વિશે અમે આપણાં યુવાનોને સાંભળ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓ સાથે સહયોગ સાધીને અમે સાંભળેલા અને મહત્વના વિષયોને ધ્યાનમાં લેતા, મને વિશ્વાસ છે કે અમે ખરેખરી જરૂરિયાતોને સંબોધતો આધુનિક ઉકેલ વિકસાવ્યો છે અને તે આપણાં યુવાન લોકોને ભવિષ્ય માટે સફળતા મેળવવા રચવામાં આવશે.”

- હરકિરત સિંહ (Harkirat Singh), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 9 અને 10, સીટી ઓફ બ્રમ્પટન

“બ્રમ્પટનનો યુવાન અને વિકસતો પ્રતિભાશાળી સમાજ આપણાં શહેર અને પ્રદેશના આર્થિક વિકાસ અને સ્પર્ધાત્મકતા માટે નિર્ણાયક છે. BramptonU માટેની આપણી યોજના આપણાં એમ્પ્લોયર્સ અને કર્મચારીઓ માટે હાલની જરૂરિયાતો અને ભાવિ તકોને સંબોધતી હોવાની ખાતરી કરવા આ શહેરે સ્થાનિક ધંધાઓ, શૈક્ષણિક ભાગીદારો, સામુદાયિક હિતધારકો અને સરકારના અન્ય સ્તરો સાથે ઘનિષ્ટપણે કામ કરવાનું ચાલુ રાખ્યું છે.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)